https://archive.org/details/bk1422/page/n0/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૨, અંક : ૯, સળંગ અંક : ૨૧ દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક નવેમ્બર : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

દીપોત્સવી અંક
તથા
દ્વિવિધ મહોત્સવ અંક

સૌને
નૂતન વર્ષાભિનંદન

પ.પૂ. જગદ્‌ગુરુ સત્‌પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ પ્રેરણાપીઠ - પીરાણા

પ્રકાશક : સત્‌પંથ પ્રકાશન સમિતિ - સત્‌પંથ પ્રેરણાપીઠ, પીરાણા, તા.દસકોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫ મૂલ્ય : ૧૨/- રૂ. વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/-

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 4, 6, 9, 11, 17.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1422/page/n2/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 15:07:04 +05'30'

realpatidar.com

વર્ષ : ૨, અંક : ૯, સળંગ અંક : ૨૧ દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક નવેમ્બર : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

દીપોત્સવી અંક તથા દ્વિવિધ મહોત્સવ અંક

॥ સનાતન સતપંથ ॥

સૌને નૂતન વર્ષાભિનંદન

પ.પૂ. જગદ્‌ગુરુ સત્‌પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ પ્રેરણાપીઠ - પીરાણા

પ્રકાશક : સત્‌પંથ પ્રકાશન સમિતિ - સત્‌પંથ પ્રેરણાપીઠ, પીરાણા, તા.દસકોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫ મૂલ્ય : ૧૨/- રૂા. વાર્ષિક લવાજમ રૂા. ૧૦૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

નૂતન વર્ષાભિનંદન

K.A. PATEL & FAMILY
KAILAS GROUP, TIRUPUR-POLLACHI

Babu Bai K. Patel - 94432 41358
SRI MAHALAKSHMI SAW MILLS, TIRUPUR
526-B, Dharapuram Road, Tirupur-8. E-mail : smsmnaveen@gmail.com

Ladharam K. Patel - 98430 42434
DHANALAKSHMI WOOD INDUSTRIES, TIRUPUR

Narshilal K. Patel - 98430 20677
KAILAS WOOD INDUSTRIES, POLLACHI

Shankarlal K. Patel - 98946 77737
AMARDEEP TIMBER, TIRUPUR
All kinds of Timber, Imported Logs & Sizes
Specialist in : Pine Wood & Burma Teak

Dayalal K. Patel - 98430 77768
KAILAS MARBLES, TIRUPUR

Mukesh S. Patel - 98941 34340
KAILAS CERAMICS (P) LTD., TIRUPUR

Dharamshi L. Patel - 98946 77757
KAILAS TRADERS, TIRUPUR

Spanio
Source of Creativity
www.spaniotile.com

Mansukh L. Patel - 98432 44038
LAKSHMI MARBLES, TIRUPUR
Dealers in : Granites, Glazed Tiles, Sanitary Wares, All Building Product
Specialist in : Spanio Imported Tiles

Himmath B. Patel - 98430 44038
ULTRA WINDOWS & DOORS, TIRUPUR
ULTRA POLYMERS (P) LTD., TIRUPUR
MFRS. UPVC WINDOWS & DOORS
MFRS. UPVC WINDOWS & PROFILE
www.ultrawindow.in

Naveen B. Patel - 93630 04808
LAKSHMI PLYWOODS, TIRUPUR
Dealers in : Plywoods, Glassed Doors, Hardware & Fittings
Specialist in : Design Glass

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n4/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

realpatidar.com

સેવા   સહકાર   સંગઠન

"ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય નમ :"

નવા વર્ષની શુભકામના

નૂતન વર્ષાભિનંદન

સ્થાપના.: - રજી. નં. સે. ૩૦૭૧૬, તા. ૧૮- ૪ - ૨૦૦૦

ધી પીરાણા લાટ સેવા સ.મં.લી.

મું. પીરાણા તા. દસક્રોઈ જી. અમદાવાદ

વિના સહકાર નહીં ઉધ્ધાર

કમીટી સભ્યશ્રીઓ

ચેરમેન : જયંતિભાઈ કરસનભાઈ છાભૈયા

૧. જયંતીભાઈ કરસનભાઈ	ભગત	વ્ય. ક. સભ્યશ્રી
૨. અરવિંદભાઈ મણીભાઈ	છાભૈયા	" "
૩. દિનેશભાઈ નારાયણભાઈ	પોકાર	" "
૪. વાડીભાઈ કાનજીભાઈ	છાભૈયા	" "
૫. કાંતિભાઈ કરશનભાઈ	ધોળુ	" "
૬. ઈશ્વરભાઈ દેવરામભાઈ	પોકાર	" "
૭. ભોગીલાલ અંબાલાલ	છાભૈયા	" "
૮. હરીભાઈ કેશરાભાઈ	પોકાર	" "
૯. શૈલેશભાઈ અરજણભાઈ	પોકાર	" "
૧૦. રમેશભાઈ અરજણભાઈ	માકાણી	" "
૧૧. ધીરૂભાઈ સવજીભાઈ	ભગત	" "
૧૨. શાંતીલાલ શામજીભાઈ	પોકાર	" "
૧૩. ચંદુભાઈ શામજીભાઈ	પોકાર	" "
૧૪. મુકેશભાઈ શામજીભાઈ	ભગત	" "

સેક્રેટરી

રમેશભાઈ ખીમજીભાઈ પોકાર

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1422/page/n5/mode/1up

Satpanth Prakash Samiti - Members List

realpatidar.com

સત્પંથ પ્રકાશ સમિતિ - પ્રેરણાપીઠ, પીરાણા (વર્ષ : ૨૦૧૩-૧૪)

સંપાદક
શ્રી શામજીભાઈ કે. પટેલ
(વડાગામ)

માનદ્ સલાહકાર
શ્રી છગનભાઈ એસ. પટેલ
(વડોદરા)

સહ સંપાદક
શ્રી બાબુભાઈ એસ. પટેલ
(મેઘકંપા)

મંત્રી
શ્રી જસુભાઈ કે. પટેલ
(વિઠ્ઠલપુરા લાટ)

સહમંત્રી
શ્રી સુરેશભાઈ એમ. પટેલ
(અમદાવાદ)

સલાહકાર
શ્રી શામજીભાઈ એલ. પટેલ
(વડોદરા)

સદસ્ય
પ્રિ. શ્રી સુરેશભાઈ એસ. પટેલ
(ખેડબ્રહ્મા)

સદસ્ય
શ્રી કે. વી. પટેલ
(ધનસુરા)

સદસ્ય
શ્રી મનોજભાઈ એન. પટેલ
(વડોદરા)

સદસ્ય
શ્રી જેઠાભાઈ કે. પટેલ
(મેરાઉ-કચ્છ)

સદસ્ય
શ્રી અમૃતભાઈ જે. રૂડાણી
(નાના અંગીયા-કચ્છ)

સદસ્ય
શ્રી બાબુભાઈ એચ. પટેલ
(અમરગઢકંપા)

સદસ્ય
શ્રી હર્ષદભાઈ જે. પટેલ
(પીરાણા લાટ)

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n6/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

સત્પંથ પ્રકાશ | નવેમ્બર - ૨૦૧૩

વર્ષ : ૨, અંક : ૯, સળંગ—અંક : ૨૧

સત્પંથ પ્રકાશન સમિતિ.

સંપાદકશ્રી :
શ્રી શામજીભાઈ કે. પટેલ (વડાગામ)
સહ સંપાદકશ્રી :
શ્રી બાબુભાઈ એસ. પટેલ (મેઘકંપા)
મંત્રીશ્રી :
શ્રી જસુભાઈ કે. પટેલ (વિઠ્ઠલપુરાલાટ)
સહમંત્રીશ્રી :
શ્રી સુરેશભાઈ એમ. પટેલ (અમદાવાદ)
સલાહકારશ્રીઓ :
શ્રી છગનભાઈ એસ. પટેલ (વડોદરા)
શ્રી શામજીભાઈ એલ. પટેલ (વડોદરા)
સદસ્યશ્રીઓ :
શ્રી પ્રિ.સુરેશભાઈ એસ. પટેલ (ખેડબ્રહ્મા)
શ્રી કરસનભાઈ વી. પટેલ (ધનસુરા)
શ્રી મનોજભાઈ એન. પટેલ (વડોદરા)
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી (મેરાઉ)
શ્રી અમૃતલાલ જે. રૂડાણી (નાના અંગિયા)
શ્રી બાબુભાઈ એચ. પટેલ (અમરગઢકંપા)
શ્રી હર્ષદકુમાર જે. પટેલ (પીરાણા લાટ)

સત્પંથ પ્રકાશ - લવાજમ દર

	ભારતમાં	વિદેશમાં
વાર્ષિક :	૧૦૦ .૦૦	૭૦૦.૦૦
ત્રિવાર્ષિક :	૨૫૦.૦૦	૧૮૦૦.૦૦
આજીવન :	૮૫૦.૦૦	૪૦૦૦.૦૦
અમર:	૧૫૦૦.૦૦	૭૦૦૦.૦૦

પ્રકાશક
સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ.
જિ. અમદાવાદ-૩૮૨૪૨૫. ફોક્સ : ૦૨૭૧૮-૨૮૮૮૭૨
સંપર્ક : ધર્મેન્દ્ર પટેલ - બુકસ્ટોલ
મો. ૯૪૨૭૩૭૧૯૪૦ ફોન : ૦૨૭૧૮-૨૮૮૮૧૨

E-mail : kutchkadavasssmajtrust@yahoo.in
kkp_pirana@yahoo.com
(Contact : Mob. No. 09797564527

Website : www.satpanth.org
www.satpanthprakashan.org
www. nishklankinarayan.com

કુરીયર્સ : બ્રિજેશ પટેલ – મો.૯૯૭૪૨૬૪૪૪૪/
આશિષ પટેલ : ૯૯૭૪૪૯૦૦૦૨

સત્યમ ઓટો કન્સલટન્ટ
૧-એ, જયવિજય સોસાયટી, ઓ.-પલીયડનગર ગાર્ડન,
પલીયડ નગર સોસાયટીની નજીક, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩
C/o. સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.

મુદ્રક : સ્મૃતિ ઓફસેટ : બી-૫/૬/૭, રવિ એસ્ટેટસ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, ટોરેન્ટો પાવરની બાજુમાં, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, ફોન : (૦૭૯) ૨૫૬૩૦૩૭૨/૭૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૧, અંક : ૧, સળંગ અંક : ૨૪૧

સંપાદકીય...

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

આત્મીય સ્નેહી જનો...

વિક્રમ સંવત ૨૦૬૯નું વર્ષ અનેક સારા નરસા સંભારણા સાથે પૂર્ણ થયું. ગત વર્ષની નબળી યાદોનું વિસ્મરણ કરી સં.૨૦૭૦ના નૂતન વર્ષની માંગલ્ય ઉષાના પ્રાગટ્ય ટાણે 'સત્પંથ પ્રકાશ'ના વાચકો, શુભેચ્છકો, સત્પંથ ધર્મ પરિવારજનો તેમજ સર્વ પ્રાણીમાત્ર જીવાત્માઓને 'સત્પંથ પ્રકાશન' પરિવાર નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુને પ્રાર્થના કરે છે કે સમગ્ર માનવ સમાજને સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ-શાંતિ બક્ષો, વર્તમાન સમયમાં જરૂરીયાતમંદોને હૂંફ અને હિંમત અર્પો અને સૌનું જીવન નિરામય બની રહો.

પ્રકાશની પર્વ દિવાળી નિશ્ચિત દિવસે જ આવે તેવું નથી. જ્ઞાનનો દીપ પ્રગટે એ જ સાચા અર્થમાં દિવાળી છે. 'સત્પંથ પ્રકાશ' સમગ્ર વર્ષ દરમ્યાન સમાજમાં સતત જ્ઞાનનાં અજવાળાં પથરાય તેવા પ્રયત્ન આપ સૌના સહકાર થકી કરી રહ્યું છે. શાસ્ત્રો દુઃખોના અંતને મુક્તિ કહે છે. મુક્તિ એક પ્રકારની જ્ઞાનાવસ્થા જ છે. જ્ઞાનના ઉજાસથી સમગ્ર સમાજના અંતરને અજવાળવા, મુક્તિના અધિકારી બનાવવા આપ સૌનો સાથ સતત મળી રહ્યો છે અને ભવિષ્યનાં નૂતન વર્ષોમાં પણ મળી જ રહેશે, એવી અંતઃકરણની મહેચ્છા સહ આપ સૌને નૂતન વર્ષાભિનંદન.

https://archive.org/details/bk1422/page/n7/mode/1up

realpatidar.com

Satpanth Religious Literature - Sadguru Vachanamrut - Gorvaani

'સદ્‌ગુરુ વચનામૃ ણી)

– હંસરાજભાઈ ગો. પટેલ, મેઘપુરાકંપા.

સદ્‌ગોર બ્રહ્માને ઓળખ્યા, મે તો સુરતા શું કર્યા પ્રણામ રે.
બ્રહ્મ રસ લાગ્યો મીઠો, મારા અંગ ઉલટ ન માય રે.

જ્યોત પ્રકાશીને તેજ કર્યા, તે તો તેજમાં તે જ સમાયો રે.
અખંડ જ્યોત ત્યાં જળ હળે, નાભી કમળથી કર્યો વિસ્તાર રે.

બાર કળા બ્રહ્માજીની કહીએ, મે તો પ્રત્યક્ષ દીઠા છે તે જ રે.
સોળ કળા વિષ્ણુ નર કહીએ, તે જ્યોતમાં સમાય રે.

પાંચ તત્વોની કાયા કરી, નવ ખંડમાં કીધા વિસ્તાર રે.
કલિયુગમાં તે ગોરનર આવીયા, સેવકોને દેવા દર્શન રે.

અહીં સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ સમજાવે છે કે; 'સદ્‌ગોર બ્રહ્માને ઓળખ્યા અને મેં તો સુરતાને કર્યા પ્રણામ' એટલે કે સુરતા થકી ધ્યાન થકી તમારામાંના પરમ તત્ત્વનો અનુભવ થવા લાગ્યો. તમારા આત્માની અનુભૂતિ થવા લાગી, ત્યારે તમારા અંગોમાં આનંદની છોળો ઉડવા લાગી. જગત નિરાળું લાગવા લાગ્યું. જ્યારે અંગ ઉપાંગમાં બ્રહ્મ રસ સુરતા થકી પેદા થવા લાગ્યો ત્યારે તે રસ મીઠો લાગ્યો એટલે કે આનંદની અનુભૂતિ થવા લાગી. સુરતા-લક્ષ નિજ સ્વરૂપમાં એકાગ્ર થતાં બ્રહ્મ રંધમાં, દશમા દ્વારમાં જ્યાં અખંડ જ્યોત (આત્મતત્ત્વ) જળ હળી રહી છે તેના દર્શન થયાં. સદ્‌ગુરુશ્રીએ એક મંત્રમાં કહ્યું છે કે –

'ગગન મંડળમાં અમીરસ હોય ત્યાં નિરંજનકા વાસા,
સુગરા હોય તે ભરભર પીએ નુગરા જાએ પ્યાસા !'

અહીં બ્રહ્માજીની બાર કળા અને વિષ્ણુની સોળ કળાનાં દર્શન થાય છે તે પ્રત્યક્ષ દેખાય છે અનુભવાય છે. તે બ્રહ્માજીની બાર કળા -અને વિષ્ણુની સોળ કળા તે જ્યોતમાં સમાઈ જાય છે. આ બધી ઘટનાઓ નાભીકમળના અજંપા થકી પેદા થાય છે. ઉત્પન્ન થાય છે અને તે પછી અનુભવાય છે. સદ્‌ગુરુશ્રીની આ વાતને જગતના ઘણા સંતોની વાતો સાથે સામ્ય આવે છે એટલે કે સદ્‌ગુરુશ્રીના ઉપદેશ જેવી વાતો બીજા ઘણા સંતોએ પણ કરી છે.

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n8/mode/1up

realpatidar.com

'ચાલી સુરતા કીયા સમાગમ, સુખ અને સેજ બિછાયા,
ઓહમ્-સોહમ્ અજંપા જાપ લગાયા, સુરતી શુન ઘર લાયા.

ઈંગલા પિંગલા આસન ઉપરે, સુક્ષ્મણા ધ્યાન લગાયા.
સોહં-સોહં બોલે છે સર્વેમાં, જોઈ લ્યોને જવાબમાં
સો. તે હું છું 'સો.તે હું છું', ઓળખજો આલાપમાં.
નાભી કમળમે નકલંકી વાસા, ચાર વેદ બ્રહ્મવાળા.
નાભી ચક્ર ઘટમાંય. સોહં ઊઠે. હંસ જપે અજંપા જાપ,
તેના તાર નવ ટૂટે રે.'

વધુમાં સદ્‌ગુરુશ્રી કહે છે; આ પાંચ તત્ત્વોની કાયા બંધાણી તેનો નવે ખંડમાં કીધો વિસ્તાર. સેવકોને દર્શન દેવા કલિયુગમાં ગોર-નર આવીયા એટલે ગોર-નર રૂપી શ્વાસ-ઉશ્વાસ-આપણી આ ઘટ કાયામાં ચાલી રહ્યો છે તે હર દમે દમ અજંપો કરી રહ્યો છે. તેમાં ધ્યાન લગાવવાથી, સુરતા લગાવવાથી, લક્ષ લગાવવાથી આત્મ તત્ત્વની અનુભૂતિનો અનુભવ થવા લાગે છે. જેથી કરી સત્ય (આત્મા) સાથે બંધન થવાથી આ જગત ઉપરથી રાગ દ્વેષ ઓછો થઈ જાય છે. મોહ માયાથી દૂર થવાય છે અને આ જગના વ્યવહારોથી જળકમળવત્ રહી આ સંસાર સાગર પાર ઉતરી જવાય છે. એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આવાગમન મટી જાય છે.

ઈંગલા પિંગલા સૂક્ષ્મણા, તે તે ચડિયા રે ત્રિવેણીને ઘાટરે.
ત્રિવેણી સંગમમાં નાહી, તે તો દશમે પામ્યા છે દર્શન રે.
સતરમી કળાનાં તો તેજ જ્યાં, તે તો પિંડ સ્વરૂપી કહેવાય રે.
દશમે દર્શન તે જઈ મળ્યા, તે તો પામ્યા છે અમર પદ રે.
કહે ઈમામશાહ સાંભળો, એમ બોલ્યા છે અમૃતવાણી રે.
સદ્‌ગોર બ્રહ્માને ઓળખ્યા, મેં તો સુરતા સું કર્યા પ્રણામ રે.

ભારતીય આધ્યાત્મિક સંતો પરમ તત્ત્વને પામવાનો આત્માને ઓળખવાનો અને તેની અનુભૂતિ થકી તેમાં લય થઈ જવાનો માર્ગ અને જે થકી મોક્ષપદને પમાય છે તે રસ્તો બતાવે છે, તે જ માર્ગ-રસ્તો સદ્‌ગુરુશ્રીએ આપણને તેમના ભક્તોને બતાવેલ છે. જુદા જુદા સંતો તેની પરિભાષામાં. ઈંગલા-પિંગલા સૂક્ષ્મણા કહે છે, કોઈ સંતો ચંદ્ર-સૂર્ય-ગુરુ કહે છે, કોઈ સંતો ગંગા-જમના સરસ્વતી કહે છે પણ તે સર્વેનો ચીંધેલો રસ્તો એક જ છે. અહીં સદ્‌ગુરુ શ્રીએ ઈંગલા-પિંગલા સૂક્ષ્મણાનો ઉલ્લેખ કરેલ છે. ડાબુ નસકોરું ઈંગલા (ચંદ્ર-ગંગા), જમણું નસકોરું તે પિંગલા (સૂર્ય-જમના) અને

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n9/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

realpatidar.com

જ્યારે તે બે નસકોરામાં પવન (શ્વાસ) સમ થતાં બંને નસકોરાં ખૂલી જઈ બંનેમાં પવન શ્વાસ એક સરખા બરાબર જ્યારે ચાલે તે ગતિને તે સમયને સૂક્ષ્મણા નાડી ચાલુ થઈ તેમ કહેવાય. સુક્ષ્મણા એટલે સરસ્વતી. ગુરુ પણ કહેવાય. જ્યારે આ સ્થિતિ સુક્ષ્મણા નાડી ચાલુ થાય ત્યારે તેનો તાર રણકાર ત્રિવેણીમાં - આજ્ઞાચક્રમાં થાય છે. બે આંખો વચ્ચે કપાળના ભાગે ત્રિવેણી સંગમ (આજ્ઞાચક્ર) થાય છે અને જ્યારે આ સ્થિતિ મનુષ્યની આવે છે, ત્યારે ત્રિવેણી સંગમ પાર કરી દશમાદ્વારે બ્રહ્મરંધમાં તેનો ઝણકાર થાય છે. જ્યાં સદ્ગોર બ્રહ્મા-આપણા આત્માનું સ્થાન (મસ્તકના ઉપરના ભાગે) આવેલું છે. ઉપર બતાવ્યા મુજબ ત્યાં 'નિરંજન કા વાસા, સુગરા હોય તે ભરી-ભરી પીએ, નગરા જાય પ્યાસા' આ સ્થિતિમાં ભક્તજન સેવક પરમ તત્ત્વની અનુભૂતિ - દર્શન કરી શકે છે. જ્યોતિ દર્શન કરી શકે છે. અનંત આકાશ સફેદ, લાલ વગેરે કરંગો નિહાળી શકે છે. તેવા સમયે ભક્તો અમીરસના ઘૂંટ પી શકે છે.

સદ્ગુરુ શ્રી કહે છે; જ્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્ણ દર્શન થાય છે અને અમરપદને પામે છે. જ્યારે આવી સ્થિતિ સેવકો-ભક્તો પ્રાપ્ત કરે છે ત્યારે તેને જગત ઉપરના રાગદ્વેષ ઊડી જાય છે. મોહ માયા કૂટ કપટ તેને અડતાં નથી. સંસારમાં રહેવા છતાં પણ તે નિર્લેપ ભાવે રહે છે. વળી સદ્ગુરુશ્રીએ બીજી જગ્યાએ તેના ઉપદેશમાં કહ્યું છ કે, જ્યારે 'ચંદ્ર સૂર્ય અને ગુરુ એક રાશિમાં આવી પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે સતયુગનો પ્રારંભ થશે.' આ ઉપદેશનો હેતુ એ છે કે ચંદ્ર સૂર્ય ડાબુ-જમણું નસકોરાનો શ્વાસ સમ થતાં ગુરુનું દ્વારા ખુલતાં એટલે કે સૂક્ષ્મણા ચાલુ થતાં તેનો તાર પુષ્પ નક્ષત્ર એટલે આજ્ઞાચક્ર-ત્રિવેણીમાં થાય છે ત્યારે દશમા દ્વારનો દરવાજો ખૂલે છે એટલે કે આત્મ-તત્ત્વ પરમ તત્ત્વની ઝાંખી થાય છે. જ્યારે મનુષ્યની આ સ્થિતિ હોય છે ત્યારે તેના તમામ રાગ દ્વેષ છૂટી જાય છે અને માત્રને માત્ર સત્ય જ ભાવો જાગે છે – સત્ય જ દેખાય છે. સત્ય જ અનુભવાય છે એટલે કે તેનામાં સત્યુગનો પ્રારંભ થયો.

સદ્ગુરુશ્રીની આવી માર્મિક વાણીને સમજીએ અને જીવનમાં ઉતારીયે તો આપણા જીવનનો પલટો થઈ જાય, જીવનની દિશા બદલી જાય, જેથી કરી જન્મ-મરણના ફેરાથી મુક્ત થઈ શકાય. માટે સદ્ગુરુશ્રીની વાણીનો હેતુ 'સુરતા શું કરો પ્રણામ' એટલે કે તેને અનુસરો જેથી મોક્ષગતિ પ્રાપ્ત થશે.

●●●

સુજ્ઞ વિજ્ઞપ્તિ

પ્રેરણાપીઠ - પીરાણામાં દર્શનાર્થે કે અન્ય કારણે આવતા યાત્રિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જ્યારે પીરાણામાં આવે ત્યારે તેમના ઓળખપત્ર જેવાં કે ઈલેક્શનકાર્ડ, લાયસન્સ, પાનકાર્ડ પોલીસ સૂચના અનુસાર અવશ્ય સાથે લાવવા વિનંતી છે.

લિ.
પ્રેરણાપીઠ વહીવટીય વિભાગ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1422/page/n10/mode/1up

realpatidar.com

સદ્ગુરુ વાણી

Satpanth Religious Literature - Sadguru Vaani

જેણે સરજા તેણે વરજો હોજી, નહીં વરજો તો જુગમ
તમે દિધેલા કૌલ તે પાલોજી, વેલા પોતીને હવે ક
તમે દિલ થકી પાતક ટાલોજી, ધરમ રાજ તમારા કરજોજી,
સતી લોકોના ભરણા ભરાસેજી, સત્ રાખો તો ઈમાન રહેસેજી.
વેલા ચોઘડિયા ગુરુ કહે છે જી, કરડા રૂપ લઈ ગુરુજી આવાજી.
તે રૂપ દેખીને દુનિયા ડરસેજી, સતી લોકોના મન તાહા ભુલસેજી,
બે ઈમાનીને અંધા હોસેજી, તે તો રચના સ્વામીની નહીં જોસેજી.
જેમ મિટી માહે નીર ભલસેજી, તેમ તે દેવલોક ટોળે મળસેજી,
જેણે ક્રિયા આચાર નહીં પાલાજી, ક્રિયા હીણે અમી પીધાજી.
અમી પીધા પણ લાણ ના લીધાજી, લાણ લીધાના ફલ કહિયેજી,
દેવ જુગતે નીત નીત જઈયેજી, ગુરુ ગતના આધિન થઈ રહિયેજી.
જાણા અજાણા પાતક કહિયેજી, કોડી દમડીની પૂજા દઈયેજી,
કોડી દેજે તો હસ્તી લીજેજી, એક કોડી વિના હસ્તી હારેજી.
એવા પંથ કોણે દેખાડા હોજી, સત્ગુરુયે ભેદ બતાવા હોજી,
અમર હુવા તે તેજ માહે મલીયાજી, મોઠી ક્રિયા જે સતે રહેનાજી.
તમે દિલ માહે અસત્ ના આણોજી, તમને જુગો જુગ ગુરુ કહેસેજી.
પૂર્વ પૂણ્ય જેણે સત્ગુરુ મલીયાજી, સત્ગુરુ બીન ખાવા ફેરાજી.
સત્ ગુરુ મલે તો ચારે ખાણ છુટેજી, એ ગીનાન બોલ્યા ઈમામશાહજી.

•••

વિજ્ઞપ્તિ

પ.પૂ. ગુરુવર્ય સંતશ્રી પ્રેમદાસબાપુ શિષ્ય મંડળ જોગ

સહર્ષ જણાવવાનું કે શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી અને સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની પરમકૃપાથી તેમજ પ.પૂ. ગુરુદેવના આશીર્વાદથી પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી પ્રેમદાસબાપુની "વાર્ષિક મહાપૂજા તેમજ શિષ્ય મિલન સમારોહ" દહેગામ મધ્યે સં. ૨૦૭૦, માગશર વદ - ૫, રવિવાર, તા.૨૨-૧૨-૨૦૧૩ના મંગલ દિને રાખવામાં આવેલ છે. જેની પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી પ્રેમદાસબાપુના સમગ્ર શિષ્યમંડળ નોંધ લેવી.

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n11/mode/1up

realpatidar.com

નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ ઐસા દિન કબ આવેગા ?

– મનસુખભાઈ પી. માકાણી, કોટડા (ચ.)આ.

કબ આવેગા કબ આવેગા નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ, ઐસા દિન કબ આવેગા ?
હમ સબ જીવોસે પ્રેમ કરે, દુશ્મન જન પર ભી રહમ કરે,
દુષ્ટો કા દોષ ભી ક્ષમા કરે...નિષ્કલંકી.
કબ આપ અવર કા ભેદ મીટે, ધન-જન ખાને કા ખેદ મીટે,
લક્ષ ચોરાશીકી કેદ મીટે... નિષ્કલંકી.
સબ પ્રાણી કો નિજ સમ પેખે હમ, પર નારી માતા દેખે હમ,
લક્ષ્મી કો મીટ્ટી લેખે હમ... નિષ્કલંકી.
જગ માયા કા વ્યવહાર છૂટે. તૃષ્ણા બંધન કે તાર તૂટે,
શીર પર પાપકા ભાર ખૂટે... નિષ્કલંકી.
વિષયોકો મનસે ત્યાગ હી દે, કુછ નહીં કૃપા બિન માગી લે,
ચિત્ત નિષ્કલંકી નારાયણ ભજન મેં લાગી રહે... નિષ્કલંકી.
સત્પંથી સાધુસંતો કી સેવા સદા ભાવે, સબ મોહ નિંદ્રા ઘટ સે દૂર જાવે.
જીવન યહ પ્રભુ મય બન જાવે... નિષ્કલંકી.
નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ, ઐસા દિન કબ આવેગા... કબ આવેગા...!
કબ આવેગા...! કબ આવેગા...!

●●●

સત્ય એ જ પરમેશ્વર

– સુરેશ ડી. પટેલ, હનુમાનકંપા, રોજડ

સત્ય એ જ પરમેશ્વર છે. માનવી પરમેશ્વરને પામવા બીજું કાંઈ ન કરે અને ફક્ત પોતાના જીવનના દરેક કાર્યમાં સત્યમય જીવન જીવે તો ઘણું બધું છે. સત્યરૂપી પરમેશ્વરને પામવા માટે માનવે અસત્ય સામે સતત સંઘર્ષ ખેલવો પડશે. શ્રેય પામવો હોય કે પ્રેમની પ્રાપ્તિ કરવી હોય તો તે બંને સત્યના માર્ગે જ મેળવી શકાય છે, નહીં કે અસત્યના માર્ગે.

આપણે આપણા જીવનની અંદર અસત્ય સામે લડતા રહેવું અને સત્યનું આચરણ જ કરવું. સત્ય તરફ જ રહેવું. અસત્યનો આશરો ન લેવો. હા ! સત્ય મેળવવું અઘરું છે અને પામ્યા પછી તેને જીરવવું એથીય અઘરું છે, પરંતુ નારાયણના દર્શન કરવા માટે સત્ય એક જ અમોઘ શસ્ત્ર છે. માટે સત્યનું આચરણ કરવું. સત્ય એ જ પરમેશ્વર.

●●●

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n12/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

realpatidar.com

સદ્‌ગુરુ શ્રી ઇમામશાહ રચિત "શ્રીમદ્ ભગવત્ દશાવતાર"

સૃષ્ટિનું નિર્માણ

Satpanth Religious Literature - Shrimad Bhagwat Dahsavatar written by Imamshah

'જ્યોતિ સ્વરૂપે જાણીયે, આદબુંદ પિંડ કહેવાય રે ।
નિરાકાર રૂપે તો પોતે છે, તે તો અકળ કહાવ્યા નવ જાય રે ॥
ઝવેરી હોવે તે પારખે, અને હીરા ચઉટે બાજાર રે ।
મુનિવર હોવે તો પારખે, જ્ઞાનની સુરતી લગાય રે ॥

પ્રાત : સ્મરણીય પરમ વંદનીય સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે આ સૃષ્ટિ તથા વિશ્વ બ્રહ્માંડના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે, પહેલાં ધરતી નહોતી, આકાશ નહોતું, મૂળ નહોતું, ન હોતી માયા અને નહોતું રજવર બીજ. કશું જ ન હોતું. સદ્‌ગુરુશ્રીએ ભગવાનના અલક્ષ સ્વરૂપનું વર્ણન કર્યું છે કે, પહેલાં એક જ્યોતિ જ હતી. તેનાથી આગળ ચંદ્ર અને સૂર્ય ન હોતા, ત્યારે છત્રીસ લાખ કરણ સુધી ભગવાનનું નિર્ગુણ નિરાકાર તેજ જ હતું. તેતાલીસ લાખ વીસ હજાર વર્ષનો એક મહાયુગ થાય. આવા બત્રીસ મહાયુગ પૂરા થયા બાદ એક કરણ થાય. આવા છત્રીસ લાખ કરણ ભગવાનનું સ્વરૂપ અવિચલ હતું. તેમનું ધ્યાન ધરવા માટે સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે જ્યોતિ સ્વરૂપ બતાવ્યું છે.

આ વિશ્વમાં પરિબ્રહ્મનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ જ હતું. આ જ્યોતિ સ્વરૂપ અનંત કોટી સૂર્યો ભેગા થઈ ઉદય થાય તેવું તેજોમય હતું. જ્યોતિ સ્વરૂપે પરિબ્રહ્મને સંશય થયો કે બ્રહ્માંડમાં તો હું એકલો જ છું. 'ભૂઃસ્યંમ્ પ્રજામયઃ' અર્થાત કે હું એકલો જ છું. પરંતુ હું અનેક સ્વરૂપે પ્રગટ થાઉં તો મારા સંકલ્પનું સમાધાન થાય અને સૃષ્ટિ નિર્માણનું કાર્ય પણ થાય. તે એવી રીતે કે જ્યારે મંદિરમાં ઘંટારવ વગાડીએ છીએ, નગારું
વગાડીએ છીએ ... અવાજ)
નીકળે છે. આ ... હદ છે.
અનહદ એટલે ... સૃષ્ટિ
નિર્માણ ન હતી ... નાદનું
નિર્માણ થઈ ગયેલું હતું. ૐ... મ્... નિનાદ સ્વરૂપે આ જ્યોતિમાંથી પરિબ્રહ્મ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પ્રગટ થયું. નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો હતું. પરંતુ ભક્તોને (જગતને) સમજાવવા માટે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કર્યું. તે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર, આ બંને સ્વરૂપ એક જ નિરંજન નિરાકાર પરિબ્રહ્મનાં છે.

જ્યોતિમાંથી જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પ્રગટ થયું તેને સચ્ચિદાનંદ સ્વરૂપ કહે છે અને આજ સ્વરૂપને આપણા શાસ્ત્રોમાં આદિ નારાયણ ભગવાન કહીએ છીએ. આ આદિ નારાયણ ભગવાન સગુણ સાકાર રૂપથી પ્રગટ થયા અને તે જ્યોતિમાંથી જ પ્રગટ થયા.

આદિ નારાયણ ભગવાનનું આ સ્વરૂપ જેવી રીતે વાયુનું સ્વરૂપ છે પણ દેખાતું નથી. તેજનું સ્વરૂપ છે પણ દેખાતું નથી. તેવી રીતે ભગવાનનું સ્વરૂપ જ્યોતિમાંથી પ્રગટ થયું પણ તે દેખાતું નથી, પરંતુ તેમાંથી તો તેમની ફક્ત આકૃતિ જ પ્રગટ થઈ છે, પછી ભગવાનને વિચાર આવ્યો કે હું તો હજી એકલો જ છું.

ત્યારે આદિ નારાયણે એકમાંથી અનેક જીવાત્માઓના સર્જનનો સંકલ્પ કર્યો. આ સૃષ્ટિની ઉત્પત્તિ માટે માયાશક્તિનું નિર્માણ કર્યું. આ માયા શક્તિ એટલે 'સચ્ચિત્ શક્તિ સ્વરૂપ' એ જ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 11 of 22

https://archive.org/details/bk1422/page/n13/mode/1up

realpatidar.com

આદ્યશક્તિ સ્વરૂપ માયાનું નિર્માણ કર્યું. ભગવાન પોતે તો જ્યોતિમાંથી જ પ્રગટ થયા. પછી તેમને માયાનું નિર્માણ કર્યું. જે નિર્માણ અને નાશ થાય છે તેનું નામ માયા. તે માયાનો હંમેશાં નાશ જ થાય છે પરંતુ પરબ્રહ્મ તત્ત્વનો નાશ થતો નથી. ત્યારે આદિ નારાયણ ભગવાને આદ્યશક્તિ સ્વરૂપે આઠ પ્રકૃતિ 'પંચ' નિર્માણ કર્યું. આ આઠ પ્રકૃતિ તે પંચ-પંચીકરણ બોલાય છે. તેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, જીવ, માયા અને બ્રહ્મ. આ આઠ પ્રકૃતિ રૂપને અષ્ટધા પ્રકૃતિ કહેવાય છે. ભગવાન નિર્ગુણ નિરાકાર સ્વરૂપે આ સૃષ્ટિ નિર્માણ કરવા માટે અષ્ટધા પ્રકૃતિ એટલે કે આદ્ય શક્તિનું નિર્માણ કર્યું. પછી ભગવાને તેમનું ધ્યાન જીવાત્મા સ્વરૂપ નિર્માણ કરવા માટે કર્યું. તે સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે ભગવાનના આ જ્ઞાનને સમજાવવા માટે મૂળબંધ નામનો ગ્રંથ લખ્યો છે, તેમાં જીવાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે. માટે અહીં લંબાણથી લખતા નથી.

પરિબ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે અને સગુણ સાકાર પણ છે અને સચ્ચિદાનંદ સ્વરૂપ પણ છે. તેઓ સત્ પણ છે અને ચિત્ત પણ છે અને બ્રહ્મ પણ છે. સત્ અને ચિત્ત જગતની રચનાથી આખર સુધી કાયમ રહે છે. સત્ અવિનાશી પણ છે. આ સત્‌ને પામવા માટે સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે સત્‌પંથ ધર્મનું દિગ્દર્શન કરાવ્યું છે. સત્‌પંથ ધર્મ એવું જ્ઞાન છે કે જીવાત્માને મુક્તિ સુધી પહોંચાડે છે.

અને આ સત્‌પંથ ધર્મના જ્ઞાનથી જીવાત્માને અવશ્ય મુક્તિ મળે છે અને આ જીવાત્માની ઉત્પત્તિ નિર્ગુણ નિરાકારથી જ થઈ છે. જે સચ્ચિત્ સ્વરૂપ છે.તેમાંથી જ જીવાત્માનું નિર્માણ થયું છે. ત્યાં જ જીવાત્માને પાછું પહોંચવાનું છે, પરંતુ આ સૃષ્ટિમાં જીવાત્મા તેના જીવનમાં જેવાં કર્મો કરે છે તે કર્મો અનુસાર તેને ફળ મળે છે. પાપ કર્મ કરે તો દુઃખદાયી ફળ મળે અને પીડિત યોનીમાં જન્મ મળે છે અને જો પુણ્ય કર્મ કર્યા હોય તો અનેક સારાં કર્મોને લીધે જીવાત્મા સ્વર્ગલોકમાં જાય છે. સ્વર્ગલોકમાં સુખ ભોગવ્યા બાદ મૃત્યુલોકમાં આવે છે. મૃત્યુલોકને કર્મભૂમિ માનવામાં આવે છે. પોતાના કર્મ અનુસાર જીવાત્મા નરકલોકમાં યાતના ભોગવતો હોય કે પછી સ્વર્ગલોકમાં સુખ ભોગવતો હોય, પણ તેના કર્મ પૂરા થયા પછી મૃત્યુલોકમાં પાછું આવવું જ પડે છે. પરંતુ જીવાત્માનું અંતિમ સ્વરૂપ સત્ છે. એટલે કે મોક્ષ સ્વરૂપ સત્ છે. એટલા માટે સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે આપણા સત્‌પંથ સાહિત્યમાં ગુરુવાણીના રૂપમાં કહ્યું છે કે :

'સત્‌પંથ ધર્મ સો કહીએ, જેણે ઓળખ્યા સત્‌ગોર નૂર રે;
પરબ્રહ્મ વિષ્ણુને ઓળખ્યા, તે તો અમર હુઆ તત્ખેવ રે.'

ચિત્ત સ્વરૂપ એવું છે કે, ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપ. જ્યાં સુધી જીવાત્મામાં ચૈતન્ય ન હોય ત્યાં સુધી તે મૃતાવસ્થામાં રહે છે. જીવાત્મામાં ચૈતન્ય આવે એટલે જીવાત્મા આત્મા તરીકે ઓળખાય છે. આત્મા તરીકે એટલે કે આત્માનું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. સચ્ચિદાનંદ એ જ ઈશ્વરનું અંતિમ સ્વરૂપ છે. ત્યાં પહોંચ્યા બાદ જીવાત્માને મુક્તિ મળે છે. જે જીવાત્મા મુક્ત થઈ જાય છે. તેને અપરિમિત આનંદ મળે છે તે આનંદમય સ્વરૂપ ઈશ્વરનું જ સ્વરૂપ છે. ભગવાને આ માયાનું માધ્યમ લઈને અષ્ઠવિધ પ્રકૃતિનું નિર્માણ કર્યું છે. તે 'પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, જીવ, બ્રહ્મ અને માયા'. આમ જીવનો જે સંબંધ આવે છે તે જીવમાં બ્રહ્મ અને અવિધાનો સંયોગ થવાથી આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે કે 'બ્રહ્મ' આ બ્રહ્મ જ સચ્ચિત્ બ્રહ્મ છે. આ અવિદ્યા, અવિધાનું સ્વરૂપ છે 'માયા'.

અવિદ્યા અને બ્રહ્મના સંયોગથી આ જીવાત્મા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1422/page/n14/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

પ્રગટ થયો છે. જીવ, માયા અને બ્રહ્મ આ જીવાત્મા છે. તે જીવાત્મા જ્યારે આ મૃત્યુલોકમાં જાય છે ત્યારે ત્યાં જેવું કર્મ કરે છે તેવું જ કર્મનું ફળ તેને મળે છે અને ફળ તે પોતે જ ભોગવે છે.

પરિબ્રહ્મ ભગવાનનું સ્વરૂપ તો નિરંજન નિરાકાર છે. તે તો આપણે આગળ જોઈ લીધું અને માયાનું સ્વરૂપ છે સચ્ચિદ્ આદ્યશક્તિ. તે શક્તિનું સ્વરૂપ પણ આપણે જોઈ લીધું. પરંતુ માયા એકલી કંઈ કરી શકતી નથી. એકલા ભગવાન પણ કશું કરી શકતા નથી. બંનેના સંયોગમાંથી જે બ્રહ્મ અને અવિદ્યા, તેના સંયોગથી જીવાત્મા પ્રગટ થાય છે. તેનું નિયંત્રણ કરવાને માટે ભગવાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દેવતાઓનું નિર્માણ કર્યું છે. બ્રહ્મા-રજોગુણ, વિષ્ણુ—સત્વગુણ, મહેશ-તામસ ગુણ છે. આમ પરિબ્રહ્મ નારાયણે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. તેનું ટૂંકું વર્ણન કર્યું છે. સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે સૃષ્ટિ નિર્માણનું વિશેષજ્ઞાન હસ્ત લિખીત 'મૂળબંધ' નામના ગ્રંથમાં સવિસ્તાર આપેલ છે.

•••

"ઈશ્વરને વારંવાર યાદ કરો"

— શકુંતલા આર. માકાણી, ગાડુકંપા

એક હાથી છે એને નવડાવી છોડી દો તો એ શું કરશે ? માટીથી રમશે અને પોતાના શરીરને ફરીથી ગંદુ કરશે. કોઈ એના પર સવારી કરશે તો એનું શરીર પણ અવશ્ય ગંદુ થશે. પરંતુ જો હાથીને સ્નાન કરાવીને પછી પાછા વાડામાં બાંધી દેવામાં આવે તો પછી હાથી પોતાનું શરીર ગંદુ નહીં કરી શકે.

મનુષ્યનું મન હાથી જેવું જ છે. એક વાર ધ્યાન-સાધના અને ભગવાનના ભજનથી શુદ્ધ થઈ જાય તો એને સ્વતંત્ર ન કરવું જોઈએ. આ સંસારમાં પવિત્રતા પણ છે, ગંદકી પણ છે. મનનો સ્વભાવ એવો છે કે એ ગંદકીમાં જશે અને મનુષ્યદેહને દૂષિત કરવાનું ચૂકશે નહિ, તેથી જ એને ગંદકીથી દૂર રાખવા એક વાડાની આવશ્યકતા હોય છે. જેમાં એ બંધાયેલો રહે અને ગંદકીની સંભાવનાઓવાળાં સ્થાનોમાં ન જઈ શકે.

ઈશ્વરનું ભજન, એનું નિરંતર ધ્યાન એક વાડો છે. જેમાં મનને બંધ રાખવું જોઈએ, તો જ સાંસારિક સંસર્ગથી ઉત્પન્ન થતા દોષો અને ગંદકીથી બચવું શક્ય છે.

ભગવાનને વારંવાર યાદ કરતા રહેશો તો મન અસ્થાયી સુખોના આકર્ષણ અને પાપથી બચી શકશે અને એને પોતાના જીવનના સ્થાયી લક્ષ્યની યાદ આવતી રહેશે. એ વખતે દૂષિત વાસનાઓમાં પડવાથી આપોઆપ ભય ઉત્પન્ન થશે અને મનુષ્ય એ પાપકર્મથી બચી જશે. જેના કારણે એ વારંવાર અપવિત્રતા અને મલિનતા ઉત્પન્ન કરતો હોય છે.

•••

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 13 of 22

https://archive.org/details/bk1422/page/n15/mode/1up

realpatidar.com

ભગવત્ નામ સ્મરણ

– પ.પૂ. મહંત શ્રી રવિદાસજી મહારાજ – પ્રેરણાપીઠ, પીરાણા

સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે તેમની વાણીમાં કહ્યું છે કે;

"હરિ સ્મરણ તણો એ છે નેમ,
સદ્‌ગુરુ સાથે નિરંતર પ્રેમ...
સર્વે સ્મરણ હરિનું કરીએ,
નિંદા જુઠ મનથી પર હરિએ...
વળી વળી એવે અવસરે જો મળીએ,
હરિ સ્મરતાં સર્વે દુઃખ ટળીએ..."

જેના ઉચ્ચારણથી આત્મામાં શાંતિ પથરાય તે ભગવન્નામ. જેનાથી વ્યક્તિ પરિપક્વ બને તે ભગવાનનું નામ. નામ આનંદદાતા છે અને મુક્તિદાતા છે. ભગવન્નામમાં જે ધ્વનિ છે તેનું સાતત્યપૂર્ણ અનુરણન વ્યક્તિમાં જૈવરાસાયણિક પરિવર્તન લાવે છે. એટલે જ ભગવાનનું નામ ઉચ્ચારણ વ્યક્તિને આમૂલ બદલી નાખે છે. નામના પ્રતાપે કેટલાક દુષ્ટ લોકો સંત બન્યાના દાખલા જોવા મળે છે. કબીર કહે છે - **"સભી રસાયન હમ કરી, નામ સમ ન કોય, તનિક ઘટમેં સંચહે, સબ તન કંચન હોય."** મેં બધા રસાયણોનું સેવન કર્યું પણ ભગવાનના નામ સમાન કોઈ નથી. આ રસાયણ એવું છે કે શરીરમાં સહેજ પણ ઉતરે તો એને એ પૂરેપૂરું કંચનવર્ણું કરી દે છે. જેમ કીમિયાથી હલકી ધાતુ સુવર્ણમાં ફેરવાઈ જાય છે તેમ આ નામ રૂપી રસાયણથી દુર્જન સજ્જન રૂપે બદલાઈ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે - હે અર્જુન ! જે મનુષ્ય મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું." દૈવી પ્રકૃતિનો આશ્રય લેનારા અને દિવ્ય જીવન જીવનારા ભગવત્સ્વરૂપના સેવા-સ્મરણ-ભજન-કીર્તન વગેરેમાં સદાય નિમજ્જ રહે છે. એના થકી પ્રાપ્ત થતો આનંદ અખૂટ હોય છે. ગમે તેટલો પીવા છતાં આ રસ કદી ખૂટતો નથી. શ્રીમદ્ ભગવદ્‌ગીતાના નવમા અધ્યાયના તેરમા અને ચૌદમા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે : હે અર્જુન ! દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વ પ્રાણીઓ અને પદાર્થોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. એ દ્રઢનિશ્ચયી ભકતો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતાં, મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતાં અને મને વારંવાર પ્રણામ કરતાં સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે."

સંત્ તુલસી દાસજી કહે છે કે; મેં મારા જીભરૂપી ઉંબરા પર રામનામરૂપી મણિ ધારણ કર્યો છે. એના લીધે મારી અંદર સદૈવ જ્ઞાનપ્રકાશ ફેલાયેલો રહે છે અને મારી બહાર પણ પ્રેમ પ્રકાશ પથરાતો રહે છે. જો માનવી પોતાની અંદર પ્રભુનું નામ ઉતરવા દે તો એનું જીવન સદૈવ ઉજ્જવળ બની રહે છે. સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે કહ્યું છે કે;

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n16/mode/1up

realpatidar.com

"નાવ કીજે હરિના નામની,
અને સાચા તે ભરીએ ભાર રે,
પવન સાથે ચાલે જો પ્રેમકા,
તો સદ્‌ગોર ઉતારે પાર રે."

પ્રભુનું નામ દિવ્ય ઔષધિનું કાર્ય કરે છે. જેના સેવનથી કાયાકલ્પ, મનકલ્પ અને આત્માકલ્પ થતાં જીવ સંસારરોગથી રહિત થાય છે.

એક ગામમાં દિવ્ય શક્તિ સંપન્ન મહાત્મા પધાર્યા. તેમની પાસે અનેક રોગોનું નિવારણ કરનારી દિવ્ય ઔષધિઓનું જ્ઞાન હતું. તે જે જડીબુટ્ટી આપે તેનાથી રોગીનો રોગ અચૂક દૂર થઈ જતો. એક દિવસ એક ધનવાન વ્યક્તિના પિતાને ગંભીર રોગ થયો. તે પેલા મહાત્મા પાસે ગયો અને રોગહર ઔષધિ લઈ આવ્યો. પિતાને તે ગળી જવા કહ્યું. પણ તેમ છતાંય પિતાનું ક્લાકેક બાદ મરણ થયું. પેલો ધનવાન માણસ દોડીને મહાત્મા પાસે ગયો અને કહ્યું કે; તેમણે આપેલી જડીબુટ્ટી આપવા છતાં તેના પિતાનો રોગ દૂર ન થયો અને તેમનું મરણ થઈ ગયું. પેલા મહાત્મા વિચારમાં પડી ગયા. આવું કદી બન્યું નથી અને બને પણ નહિ. છતાં આવું કેમ બન્યું ? તે જાતે પેલા ધનવાનના પિતાને જોવા ગયા. તેમની પાસે જઈ તેના મૃતદેહ પાસે બેસી ગયા. તેમણે તેનું મોં ખોલીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પેલી જડીબુટ્ટી મોઢામાં જ હતી. તેની કડવાશને લીધે પેલા વૃદ્ધે તેને પોતાના શરીરમાં ઉતારી જ નહોતી ! મહાત્માએ તે જડીબુટ્ટી મોઢામાંથી બહાર કાઢી તેના પુત્રને બતાવી અને તેમના મરણનું કારણ જણાવ્યું. જો તેમણે તે પેટમાં ઉતારી હોય તો જરૂર તેમનો રોગ મટી ગયો હતો.

ભગવાનનું નામ દિવ્ય જડીબુટ્ટી જેવું છે. તેને ખાલી મોઢામાં જ રાખીએ તો તે કોઈ લાભ કરી શકતું નથી. તેને અંદર ઉતારી ઓળઘોળ કરી દેવું જોઈએ. સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજ કહે છે કે;

"નામ લીધામાં અંતર ઘણા,
જે પ્રેમસુ પ્રીતના લાએ રે,
ધૂળ ઉપર જેમ લીપણ,
જેમ ફૂટા માદલ બજાએ રે."

•••

નૂતન વર્ષાભિનંદન

કે. વી. પટેલ
(ભુટાલકંપાવાળા)
ચેરમેન : કલબ મેમ્બર એજન્ટ

સંવત ૨૦૭૦નું નવું વર્ષ આપના જીવનમાં સર્વ પ્રકારે આનંદમય અને મંગલમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.

મારી જીવન વિમા એજન્ટ તરીકેની કામગીરીની શરૂઆત તા.૧૧-૯-૧૯૬૧ના રોજ કરેલ હતી. આપ સર્વ વિમેદારો, સર્વ મિત્રો તેમજ મારા શુભેચ્છકોના સહકારથી મારી જીવન વિમા એજન્ટ તરીકેની કામગીરીના ૫૨ (બાવન) વર્ષ આ તબક્કે પૂર્ણ કરેલ છે. સમગ્ર ભારતમાં વસતા કચ્છ કડવા પાટીદાર સમાજમાં જીવન વિમા એજન્ટ તરીકે સતત ૫૨ (બાવન) વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ એજન્ટ છું. મારી આ કામગીરીનો યશ આપ સર્વના ફાળે જાય છે. મારી આ જીવન વિમા એજન્ટ તરીકેની ૫૨ (બાવન) વર્ષની સિદ્ધિ બદલ હું આપ સર્વ વિમેદારો, મિત્રો તેમજ શુભેચ્છકોનો આભાર માનું છું.

મારી આ જીવન વિમાની કામગીરીને વધુ વેગવાન બનાવવા નવા વર્ષમાં સહભાગી બનશો તેવી સહ નૂતન વર્ષાભિનંદન...

લી.
કે. વી. પટેલ
જીવન વિમા એજન્ટ - ધનસુરા.

અજીવન ચેરમેન કલબ મેમ્બર એજન્ટ લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા ચાર રસ્તા, કોલેજ રોડ, મુ. પો. તા. ધનસુરા, જિ. સાબરકાંઠા, ગુજરાત. પીન : ૩૮૩૩૧૦
મો. : ૯૪૨૭૦૪૮૧૬૩ (ફોન) : ૦૨૭૭૪૨૨૨૨૮૫

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n17/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

realpatidar.com

પિતૃદોષ નિવારણ વિધિ પ્રેરણાપીઠ; પીરાણા : સંવત-૨૦૭૦

સંવત ૨૦૭૦ના વર્ષમાં પ્રેરણાપીઠ પીરાણા મધ્યે પિતૃદોષ નિવારણ વિધિ (નારાયણ બલી) તથા બાવન ક્રિયાની વિધિ તેમજ ગુના છોડાવવાની વિધિ નીચેના નક્કી કરેલા દિવસો દરમ્યાન વિધિ કરવામાં આવશે. નક્કી કરેલા દિવસો સિવાય ઉપરોક્ત વિધિ કરવામાં આવશે નહીં. તેની સૌ ભાવિક ભક્તજનોએ નોંધ લેવી.

મહિનો	તિથિ	વાર	તારીખ	મહિનો	તિથિ	વાર	તારીખ
કારતક	સુદ-૧૫	રવિવાર	૧૭-૧૧-૨૦૧૩	જેઠ	સુદ-૧૫	શુક્રવાર	૧૩-૬-૨૦૧૪
કારતક	વદ-૧૪/૩૦	સોમવાર	૨-૧૨-૨૦૧૩	જેઠ	વદ-૩૦	શુક્રવાર	૨૭-૬-૨૦૧૪
માગશર	સુદ-૧૫	મંગળવાર	૧૭-૧૨-૨૦૧૩	અષાઢ	વદ-૩૦	શનિવાર	૨૬-૭-૨૦૧૪
માગશર	વદ-૩૦	બુધવાર	૧-૧-૨૦૧૪	શ્રાવણ	સુદ-૧૫	રવિવાર	૧૦-૮-૨૦૧૪
પોષ	સુદ-૧૫	ગુરુવાર	૧૬-૧-૨૦૧૪	શ્રાવણ	વદ-૩૦	સોમવાર	૨૫-૮-૨૦૧૪
પોષ	વદ- ૩૦	ગુરુવાર	૩૦-૧-૨૦૧૪	ભાદરવા	સુદ-૧૫	મંગળવાર	૯-૯-૨૦૧૪
મહા	સુદ-૧૫	શુક્રવાર	૧૪-૨-૨૦૧૪	ભાદરવા	વદ-૩૦	બુધવાર	૨૪-૯-૨૦૧૪
મહા	વદ-૩૦	શનિવાર	૧-૩-૨૦૧૪	આસો	સુદ-૧૫	બુધવાર	૮-૧૦-૨૦૧૪
ફાગણ	સુદ-૧૫	રવિવાર	૧૬-૩-૨૦૧૪	**સંવત- ૨૦૭૧**			
ચૈત્ર	સુદ-૧૫	મંગળવાર	૧૫-૪-૨૦૧૪	કારતક	સુદ-૧૫	ગુરુવાર	૬-૧૧-૨૦૧૪
ચૈત્ર	વદ-૩૦	મંગળવાર	૨૯-૪-૨૦૧૪	કારતક	વદ-૩૦	શનિવાર	૨૨-૧૧-૨૦૧૪
વૈશાખ	સુદ-૧૫	બુધવાર	૧૪-૫-૨૦૧૪	માગશર	સુદ-૧૫	શનિવાર	૬-૧૨-૨૦૧૪
વૈશાખ	વદ-૩૦	બુધવાર	૨૮-૫-૨૦૧૪	માગશર	વદ-૧૪/૩૦	રવિવાર	૨૧-૧૨-૨૦૧૪

નોંધ : સંવત ૨૦૭૦ના ફાગણ વદ - ૩૦, અષાઢ સુદ-૧૫, આસો વદ- ૩૦ આ ત્રણ દિવસો દરમ્યાન ઉપરોક્ત વિધિ થશે નહીં. જેની સૌ ભાવિક ભક્તજનોએ નોંધ લેવી.

સંવત - ૨૦૭૦ના ચંદ્રદર્શન તિથિની યાદી :

મહિનો	તિથિ	વાર	તારીખ	મહિનો	તિથિ	વાર	તારીખ
કારતક	સુદ-૧	સોમવાર	૪-૧૧- ૨૦૧૩	જેઠ	સુદ-૨	શુક્રવાર	૩૦-૫-૨૦૧૪
માગશર	સુદ-૨	બુધવાર	૪-૧૨- ૨૦૧૩	અષાઢ	સુદ-૧	શનિવાર	૨૮-૬-૨૦૧૪
પોષ	સુદ-૧	ગુરુવાર	૨-૧-૨૦૧૪	શ્રાવણ	સુદ-૧	સોમવાર	૨૮-૭-૨૦૧૪
મહા	સુદ-૨	શનિવાર	૧-૨-૨૦૧૪	ભાદરવા	સુદ-૨	બુધવાર	૨૭-૮-૨૦૧૪
ફાગણ	સુદ-૧	રવિવાર	૨-૩-૨૦૧૪	આસો	સુદ-૧	ગુરુવાર	૨૫-૯-૨૦૧૪
ચૈત્ર	સુદ-૨	મંગળવાર	૧-૪-૨૦૧૪	**સંવત - ૨૦૭૧**			
વૈશાખ	સુદ-૧	બુધવાર	૩૦-૪-૨૦૧૪	કારતક	સુદ-૨	શનિવાર	૨૫-૧૦-૨૦૧૪
				માગશર	સુદ-૧	રવિવાર	૨૩-૧૧-૨૦૧૪

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1422/page/n18/mode/1up

realpatidar.com

પ.પૂ. બ્રહ્મલીન આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજનો

દ્વિવિધ મહોત્સવ

પરમ જ્યોતિ વિલિનપર્વ-જગદ્‌ગુરુપદ પ્રતિષ્ઠા ઉજવણી

Karsan Kaka Death anniversary

— બાબુભાઈ એસ. પટેલ, મેધકંપા.

સં. ૨૦૬૯ના આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા) તા. ૧૮-૧૦-૨૦૧૩, શુક્રવારના દિને સત્પંથ પ્રેરણાપીઠ પીરાણા સ્થાનકે "દ્વિવિધ મહોત્સવ" (આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસ મહારાજ-પરમજ્યોતિ વિલિન પર્વ તથા જગદ્‌ગુરુપદ પ્રતિષ્ઠા) ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે સત્પંથ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અગણિત સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સંતો-મહંતોએ આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજને પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

ઉપરોક્ત પ્રસંગે સૌ સંતોએ પ્રથમ આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજના સ્મૃતિ ધામે બ્રહ્મલીન જગદ્‌ગુરુ મહારાજના શ્રીચરણોનાં પૂજન અર્ચન કરી પુષ્પજંલિ અર્પિત કરી હતી. ત્યાર બાદ ધર્મસભામાં દીપ પ્રાગટ્ય કરી આજના પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ સર્વ સંતોએ સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજના પ્રતિકને તથા આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજના પ્રતિકને પૂજન-ફૂલહાર અર્પણ કરી આસન ગ્રહણ કર્યાં હતા.

ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ પટેલ (નવસારી)એ સંતો-મહંતો, મહાનુભાવો તેમજ હરિભક્તોનું શાબ્દિક સ્વાગત કરતાં કહ્યું કે; ઉપસ્થિત સૌ સંતો-મહંતો-હરિભક્તોનું આ પ્રસંગે હૃદયપૂર્વક સ્વાગત અભિવાદન કરું છું. આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજે આપણા સત્પંથ સંપ્રદાયને ઉજાગર કર્યો છે. તેમની ભાવના અને ઉદ્દેશો તેમજ સંકલ્પોની પૂર્ણ કરવાની જવાબદારી આપણી છે. આ અવસરે પધારેલા સૌનું સ્વાગત છે.

બાદમાં સૌ સંતોનાં ચંદન તિલકથી પૂજન આજના બ્રહ્મભોજનના દાતાશ્રીઓ શ્રી વિનોદભાઈ કાનજીભાઈ દેવજીભાઈ વાસાણી (વિરાણીકચ્છ) તથા શ્રી રતનશીભાઈ શામજીભાઈ વાસાણી (વડવા-કચ્છ) તથા ફૂલહારથી સ્વાગત શ્રી ઈમામશાહ મહારાજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યાં.

આજના પ્રસંગે સૌ સંતોએ આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજના "પરમ જ્યોતિ વિલન પર્વ તથા જગદ્‌ગુરુપદ પ્રતિષ્ઠા" મહોત્સવ પર્વ નિમિત્તે બ્રહ્મલીન જગદ્‌ગુરુશ્રીએ તેમના જીવનકાળ દરમ્યાન તેમને કરેલાં કાર્યોને યાદ કરી પૂર્ણ ભાવથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પિત કરતાં કહ્યું કે -

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n19/mode/1up

realpatidar.com

પૂ. પંડિતશ્રી છગનબાપા (વડોદરા) એ કહ્યું; જે જીવાત્માએ પુણ્ય કાર્યો કર્યાં હોય, પરોપકાર કાર્યો કર્યાં હોય તેમની પુણ્યતિથિ ઉજવાય. આદ્ય જગદ્ગુરુ આપણા વચ્ચેથી લીલા કરી વિદાય થયા. તેમનામાં રહેલા કર્મવીર, ધર્મવીર અને શૂરવીર જેવા સદ્ગુણો કેળવી તેમના ચિંધ્યા રાહે ચાલી, સંગઠીત બની સતપંથ ધર્મનો જય જયકાર થાય તેવા પ્રયત્ન કરીએ. સદ્ગુરુએ જે માર્ગ દર્શાવ્યો હતો તે જ માર્ગે જ જગદ્ગુરુશ્રી કરસનદાસજી મહારાજે કાર્ય કર્યાં હતાં. તેઓ પ્રાણની પરવા કર્યાં વગર કર્મવીર બન્યા હતા. ધર્મવીર બનીને રાષ્ટ્રીય સંત બન્યા હતા. દેવર્ષિ બન્યા પછી તેઓ સંકલ્પ દ્વારા જગદ્ગુરુનું પદ મેળવવામાં સફળ રહ્યા. તેમના જીવનની જેટલી ગાથાઓ ગાઈએ તેટલી ઓછી છે. તેમનું દિવ્ય સ્વરૂપ પૂ. જગદ્ગુરુશ્રી નાનકદાસજી મહારાજના ખોળિયામાં કામ કરી રહેલ છે. પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે એ જ પ્રાર્થના સહ મારી ભાવાંજલિ અર્પણ કરું છું

પૂ. સંતશ્રી પ્રેમદાસબાપુ (પંચવટી-દહેગામ) એ તેમની વાણીમાં કહ્યું કે; પૂ. આદ્ય જગદ્ગુરુશ્રી કરસનદાસજી મહારાજનું વ્યક્તિત્વ નિર્મળ-નિરાભિમાની હતું. જગદ્ગુરુનું પદ મળ્યું પણ તેમનામાં સહેજ પણ અહંકાર ન હતો. તેમનામાં ભક્ત-દાતા અને શૂરવીરના ગુણો હતા. તેઓ કર્મ નિષ્ઠ ધર્મનિષ્ઠ હતા. તેમના જીવનમાં કેટલાય શારીરિક કષ્ટો સહન હતાં છતાં તેઓ મોજમાં રહેતા. શ્રદ્ધામાં અડગ હતા. એવા મહાપુરુષને આ પ્રસંગે મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

પ.પૂ. મહંતશ્રી સોમદાસજી મહારાજ (સતપંથ આશ્રમ-દિવાળીપુરા) એ કહ્યું કે; આદ્ય જગદ્ગુરુએ શૂન્ય મેસે સર્જન કિયા. વો અમરહો ગયે હૈ. વહ મેવાસકે આદિવાસી પોંકી ચિંતા કરતે થે. ઉસને અપની શક્તિસે જગદ્ગુરુપદ લિયા. હમ ભી શક્તિ જાગૃત કરે ઔર આગે બઢે. ઈસ અવસર પર હમ ઉસે શ્રદ્ધાંજલિ અર્પણ કરતે હૈ.

પ.પૂ. મહંતશ્રી રવિદાસજી મહારાજ (પ્રેરણાપીઠ-પીરાણા) એ કહ્યું કે; આ પ્રસંગે આપણે આદ્ય જગદ્ગુરુશ્રી કરસનદાસ મહારાજના ચરણોમાં નમસ્કાર કરી તેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણું જીવન ધન્ય બનાવીએ. આ પ્રસંગે આદ્ય જગદ્ગુરુને મારી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ.પૂ. મહંતશ્રી પુરુષોત્તમદાસજી મહારાજ (ગુરુકુળ, પ્રેરણાપીઠ-પીરાણા) એ કહ્યું કે; બ્રહ્મલીન શ્રી કરસનદાસજી મહારાજે તેમના જીવનમાં કષ્ટ વેઠીને ઘણાં જ સુંદર કાર્યો કર્યા છે. તેમને કદી ન ભૂલાય. તેમના આશીર્વાદ કાયમ આપણા ઉપર રહેશે. તેને સ્થાપિત કરેલ ગુરુકુળ આજે ગુજરાતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. એવા ગુણગ્રાહી પૂ. આદ્ય જગદ્ગુરુશ્રીને આ પ્રસંગે મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

પ.પૂ. મહંતશ્રી શામળદાસજી મહારાજ (પ્રેરણાપીઠ-પીરાણા) એ તેમની વાણીમાં કહ્યું કે; આજે આદ્ય જગદ્ગુરુ મહારાજની પુણ્યતિથિ પ્રસંગ છે. તેમને જીવનમાં ઘણાં જ સત્ કાર્યો કર્યાં છે. તેમને સતપંથ સંપ્રદાય માટે ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો. કેટલાંય સંત સંમેલનો તેમની દીર્ઘ દૃષ્ટિથી પ્રેરણાપીઠ તેમજ અન્ય વિભાગોમાં થયાં. તેમના આશીર્વાદ અને પ્રેરણાથી પૂં.શ્રી નાનકદાસજી મહારાજ આજે

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n20/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

તેમના સંકલ્પનાં અધૂરાં રહેલાં કાર્યો પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે આજે હું તેમને મારા ભાવથી ભાવાજંલિ અર્પણ કરું છું.

પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ (સંત નાયાજી મહારાજ સંસ્થાન, કુકસ) એ કહ્યું કે; આપણા સૌના લોકલાડીલા આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસ મહારાજે ધર્મ ઉજાગર કરવા જે કષ્ટો સહન કર્યાં તે નિમિત્તે જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. તેમને જેટલી ઉપમા આપીએ એટલી ટૂંકી પડે. તેમના સદ્‌ગુણોની પ્રેરણા લઈ આપણા જીવનમાં ઉતારીએ. તેમનાં માતા પિતાના સંસ્કાર તેમને મળ્યા હતા. તે ધર્મ અને સમાજને ખૂબ જ કામમાં આવ્યા. તેઓ પ્રત્યક્ષ હાજર હતા ત્યારે આપણે કોઈ ઓળખી ન શક્યા. તેમના સત્કાર્યોની સુવાસ ચોતરફ ફેલાયેલી છે. તેમનો આત્મા અમર છે.

આપણે આપણા ધર્મને સંગઠિત બની તન, મન-ધનથી દીપાવીએ. ત્યારે જ એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી કહેવાશે. આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજ આજની શરદપૂર્ણિમાની જેમ પ્રકાશ પ્રસારી ગયા છે. પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તેમના માર્ગે આવીને ધર્મને પ્રકાશિત કરી રહ્યા છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ જ પ્રાર્થના સાથે મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું.

પ.પૂ. મહંતશ્રી જયરામદાસજી મહારાજ (શ્રી નિષ્કલંકી ધામ-નખત્રાણા) એ તેમની વાણીમાં કહ્યું કે; ધર્મ પ્રકાશ (જ્ઞાન) આપવાનું કાર્ય કરે છે. ધર્મમાં પાવર (શક્તિ) છે. તેવી જ શક્તિ આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજમાં હતી. જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે. મનને ધર્મ સાથે કઈ રીતે જોડવું તેની ચાવી મહાપુરુષો પાસે હોય છે. મહાપુરુષો દિક્ષા સૂચન કરે છે. સંતો મનુષ્યને જગાડે છે. સત્પંથ સત્યના આધારે છે, પૃથ્વીનો આધાર સત્ય ઉપર છે. સત્યના રાહે ચાલે તે સત્પંથી. આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજે સત્યનો માર્ગ ઉજાગર કર્યો. પૂ. કરસનદાસજી મહારાજ પાણી પહેલાં પાળ બાંધી પરિણામ લાવતા. આદ્ય જગદ્‌ગુરુનો આત્મા જયાં બિરાજતો હોય ત્યાં પરમાત્મા તેમને ... સુખ અર્પે એ જ પ્રાર્થના સહ મારી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ.પૂ. મહંતશ્રી વિષ્ણુકાકા મહારાજ (આઠિયા સંસ્થા ટ્રસ્ટ-પ્રેરણાપીઠ-પીરાણા) એ તેમની વાણીમાં કહ્યું કે; ધર્મને ટકાવવા ગમે તેટલી આફતો આવે તેમાંથી માર્ગ કાઢી આપણા સ્વધર્મને માર્ગે ચાલીએ. અંતે સત્યનો જ વિજય થાય છે. જેમ શબરીને રામ ઉપર વિશ્વાસ હતો. તેમ આપણે પણ વિશ્વાસ રાખીએ કે એક દિવસ જરૂર શ્રી નિષ્કલંકી ભગવાન આવશે.

આદ્ય જગદ્‌ગુરુશ્રી કરસનદાસજી મહારાજ લોખંડી પુરુષ હતા. સત્પંથ ધર્મને પ્રતિષ્ઠિત કરવા માટે સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની પ્રેરણાથી તેઓ ગાદીપતિ બન્યા હતા. તેઓ કર્મવીર, ધર્મવીર અને શૂરવીર હતા. તેમને ધર્મનો ખૂબ જ વિકાસ કર્યો. તેમનું જીવન પ્રેરણાદાયક હતું. તેઓની પ્રેરણા સદા આપણી સાથે જ છે. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન તેમના આત્માને પરમ શાંતિ આપે એ પ્રાર્થના સાથે મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પું છું.

પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ (પ્રેરણાપીઠ-પીરાણા) એ તેમની

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1422/page/n21/mode/1up

2013-11 -Satpanth Prakash (1422)

realpatidar.com

દિવ્યવાણીમાં કહ્યું કે; આજે આદ્ય જગદ્ગુરુશ્રી કરસનદાસજી મહારાજના પુણ્યતિથિ પર્વ પ્રસંગે આપણે સૌ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરીએ. તેમને સત્પંથ ધર્મને પ્રકાશિત કરવા અત્યંત કષ્ટો વેઠ્યાં છે. સંત સમિતિ સાથે જોડાણ કરી સત્પંથ ધર્મને સર્વ ધર્મ ક્ષેત્રે અગ્રણીય હરોળમાં મૂકી દીધો. ધર્મ રક્ષા કાર્યને જોઈ મુંબઈ સંતસંમેલનમાં જગદ્ગુરુ શંકરાચાર્યએ તેમને 'યુગ પુરુષ'ની પદવી આપી તેમનું સન્માન કર્યું હતું. આદ્ય જગદ્ગુરુશ્રી કરસનદાસજી મહારાજે ધર્મ માટે સમાજ માટે જેટલું કાર્ય કર્યું છે. તેટલું કોઈ ન કરી શકે. તેમનામાં ભક્ત-દાતા અને શૂરવીરનાં સદ્ગુણો હતા. તેઓ જીવનમાં કદી હિંમત નહોતા હારતા. ભક્તિના યોગે તેમને જગદ્ગુરુનું પદ પ્રસ્થાપિત કર્યું. તેમને સત્પંથ ધર્મનો ખૂબ વિકાસ કર્યો છે. તેઓ અખિલ ભારતીય સંત સમિતિના નેતૃત્વમાં ધર્મરક્ષા-રાષ્ટ્રરક્ષા-ગૌરક્ષાનું અભિયાનમાં સદા અગ્રેસર રહેતા. તેમને સંસ્કાર-સંસ્કૃતિ અને વ્યસનમુક્તિનું અભિયાન ચલાવી સત્પંથ ધર્મ સદા નિર્વ્યસન બને, સંસ્કારી બને તે માટે સતત પ્રયત્ન કર્યા હતા. તેઓ હિન્દુધર્મના જાગ્રત પ્રહરી હતા. આપણે સૌ તેમના જીવનમાંથી બોધપાઠ લઈ આપણા જીવનને ઉજવળ બનાવીએ. આવા મહાપુરુષની આજે પુણ્યતિથિ પ્રસંગે તેમને યાદ કરી પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો પુણ્યશાળી દિવ્ય આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં તેમને પરમ શાશ્વત સુખ શાંતિ અર્પે એ જ પ્રાર્થના સાથે ભાવભરી ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

અંતમાં આ પર્વ પ્રસંગે પ્રસંગને ઉજવવામાં સહયોગ આપનાર સૌ સેવકોને, આયોજકોને તેમજ આજના પ્રસંગના બ્રહ્મભોજન-મહાપ્રસાદના દાતાઓ સર્વને આશીર્વાદ આપું છું.

વિશેષમાં આ પ્રસંગે પૂ. જગદ્ગુરુ રામાનંદાચાર્ય સ્વામી હંસદેવાચાર્યજી મહારાજ હરિદ્વાર (રાષ્ટ્રીય મુખ્ય નિર્દેશકશ્રી : અ.ભા. સંત સમિતિ), પૂ. કૈવલજ્ઞાન પીઠાધિશ્વર કુવેરાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ-સારસાપુરી (રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી - અ.ભા. સંત સમિતિ), પૂ. મહામંડલેશ્વર સ્વામીજી અલખગીરીજી મહારાજ-વિશ્વ ગાયત્રીપીઠ, કાસોર (રાષ્ટ્રીય કોષાધ્યક્ષશ્રી-પશ્ચિમાચલ અધ્યક્ષશ્રી : અ.ભા. સંત સમિતિ), પૂ. મહામંડલેશ્વરશ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર-અમદાવાદ) વગેરે સંતોએ ટેલિફોનક ડાયરેક્ટર શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યા હતા. તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમનો લેખિત શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવ્યો હતો.

અંતમાં છેલ્લે આ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી જસુભાઈ કે. પટેલે આભારદર્શન વ્યક્ત કરતા કહ્યું કે; પધારેલા સંતો-મહંતો-મહાનુભાવો-ભાવિક હરિભક્તો સૌએ આ પ્રસંગને દીપાવ્યો-શોભાવ્યો, સૌ આ પ્રસંગે હાજર રહ્યા તે બદલ ખૂબ ખૂબ આર્તભાવથી આભાર માનું છું.

આજના આ દ્વિવિધ પર્વનું સમગ્ર સંચાલન શ્રી જસુભાઈ કે. પટેલ તથા પ્રિ. શ્રી એસ.એમ. પટેલે કર્યું જે ખૂબ જ પ્રસંશનીય રહ્યું હતું.

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1422/page/n22/mode/1up

realpatidar.com

૧૦,૦૦૦ થી વધુ મંત્રજાપ સંખ્યા જે યુવાનો તથા વડીલોની છે તેમની ફોટા સાથે નામાવલી

મંજુલાબેન એન. પટેલ
વડવાકાંયા-નખત્રાણા
જાપ સંખ્યા : ૨૦૦૦૦

ભાવનાબેન બી. પટેલ
મલ્હાર સોસા., પૂના
જાપ સંખ્યા : ૧૦૧૬૮

ચંદાબેન આર. પટેલ
મદાપુરકંપા, મોડાસા
જાપ સંખ્યા : ૩૦૦૦૦

લક્ષ્મીબેન એ. પટેલ
રામપુર - રબકવી
જાપ સંખ્યા : ૩૦૦૦૦

અનુબેન વી. માછી
વિદ્યાનગર-આણંદ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

સરલાબેન પી. ભગત
દરશડી - માંડવી
જાપ સંખ્યા : ૨૦૦૦૦

મિત્તલબેન આર.પટેલ
માધાપર - ભૂજ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

નીતાબેન એસ. પોકાર
કુબાધરોલકંપા-વડાલી
જાપ સંખ્યા : ૧૦૧૬૮

ચંપાબેન બી. પોકાર
નાનીખાખર-માંડવી
જાપ સંખ્યા : ૧૦૧૬૮

ઉષાબેન એન. પટેલ
રંગીનપુરાલાટ-ઠાસરા
જાપ સંખ્યા : ૭૦૦૦૦

પ્રિતીબેન વી. પટેલ
લક્ષ્મણપુરાકંપા-વડાલી
જાપ સંખ્યા : ૨૦૦૦૦

મુક્તિબેન ડી. પટેલ
દરશડી - માંડવી
જાપ સંખ્યા : ૧૦૧૬૮

રસીલાબેન એસ. પટેલ
માધવપાર્ક-મોડાસા
જાપ સંખ્યા : ૨૦૦૦૦

ઝવેરબેન ડી. પટેલ
નાનીખાખર-માંડવી
જાપ સંખ્યા : ૧૦૧૬૮

રતનબેન જી. પટેલ
ગાડુકંપા-ખેડબ્રહ્મા
જાપ સંખ્યા : ૧૦૧૬૮

મધુબેન એસ. માકાણી
કોટડા(ચ.)આ.-ભૂજ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

ભૂમિબેન જી. પટેલ
લાભપુરા-ઠાસરા
જાપ સંખ્યા : ૧૦૧૬૮

મીનાબેન એન. પટેલ
ચાંપલપુરફાર્મ-દહેગામ
જાપ સંખ્યા : ૩૦૦૦૦

સુમીતાબેન આર. લીંબાણી
નાનીખાખર-માંડવી
જાપ સંખ્યા : ૧૦૧૬૮

પુષ્પાબેન ડી. પટેલ
કુકસ-શિનોર
જાપ સંખ્યા : ૧૦૧૬૮

સંગીતાબેન એસ. નાકરાણી
ભવાનપુરાલાટ-બાલાસિનોર
જાપ સંખ્યા : ૧૦૧૬૮

ઝવેરબેન એસ. પટેલ
દુર્ગાપુર-માંડવી
જાપ સંખ્યા : ૨૦૦૦૦

જ્યોતિબેન એન. પટેલ
ઘાટકોપર (વે.)-મુંબઈ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

વસંતભાઈ સી. પટેલ
બોરભાઠા-સુરત
જાપ સંખ્યા : ૧૨૦૦૦૦

રજનીકાન્ત પી. સેંઘાણી
દરશડી-માંડવી
જાપ સંખ્યા : ૧૦૧૬૮

નંદુભાઈ ડી. પટેલ
ચાંપલપૂર ફાર્મ-દહેગામ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

પરેશભાઈ પી. ભાવાણી
આણંદસર (મં.)-ભૂજ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

કરસનભાઈ પી. ભગત
પંચવટી - નાસિક
જાપ સંખ્યા : ૧૩૦૦૦૦

લક્ષ્મણભાઈ આર. મહાજન
ધાનોરા-જલગાંવ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

રમેશભાઈ ડી. પટેલ
બલદાપૂર (વે.) મુંબઈ
જાપ સંખ્યા : ૧૦૧૬૮

realpatidar.com

https://archive.org/details/bk1422/page/n23/mode/1up

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18/05/2012.
Registered Under Postal Registration No. GAMC - 1830-2012-2014 By S.S.P. Ahmedabad City DN
Valid up to 31st December 2014. Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતુ માસિક

આ અંકના વિશિષ્ટ સહયોગી જ્ઞાનદાતા

"સત્પંથ પ્રકાશ" ના નવેમ્બર-૨૦૧૩ ના અંક માટેનો આર્થિક સહયોગ "જ્ઞાનદાતા" (૧) સ્વ. શ્રી ખીમજીભાઈ અરજણભાઈ છાભૈયા પરિવાર, હ. બાબુભાઈ - મુ. તિરૂપુર (તામિલનાડુ) તરફથી રૂા. ૩૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંત્રીસ હજાર) પ્રાપ્ત થયેલ છે. સત્પંથ પ્રકાશન સમિતિ તેઓશ્રીના આ "જ્ઞાનદાન" નો સહર્ષ સ્વીકાર કરે છે.

શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન અને સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની કૃપા સદાય તેમની ઉપર રહે તેવા પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંપાદક શ્રી શામજીદાદાના અભિનંદન સહ આશીર્વાદ...

રવાના :
સતપંથ પ્રકાશ
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

To, ______________________
____
____
____

Printed, and Published by **SHAMJIBHAI K. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Smruti Offset,** B/5, Ravi Estate, Rustom Mill Compound, Near Torrent Power, Near Water Tank, Dudheshwar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Premnapith, At - PIRANA - 382 425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHAMJIBHAI K. PATEL**

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com